801, "Everest", Opp. Shashtri Maidan, Rajkot - 360 001 (Guj.)
Phone: 0281-2226097 Fax: 2232918 Email: investorinfo@acesoftex.com

CIN: L72200GJ1994PLC022781 Website: www.acesoftex.com

April 05, 2024

To,
BSE Limited
Corporate Relations Department,
Phiroze Jejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001.
Scrip Code: 531525

Sub: Newspaper Advertisements for Recommendation of Committee of Independent Directors (IDC) for Open Offer

Ref.: Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir / Madam,

With reference to the captioned Subject, we, Ace Software Exports Limited ("the company") are submitting herewith the enclosed copies of Newspaper Advertisements in respect of Recommendations of the Committee of Independent Directors ("IDC") of the Company in relation to the open offer to the public shareholders of the Target Company ("Open Offer") made by Amit Mansukhlal Mehta ("Acquirer") together with Vaishali Amit Mehta ("PAC").

The information was published in the following editions on April 05, 2024.

Newspaper	Language	Edition
Financial Express	English	All
Jansatta	Hindi	All
Rajkot Mirror	Gujarati	Rajkot
Navshakti	Marathi	Mumbai

This is for your information and records.

Thanking you,

Yours faithfully,

For, Ace Software Exports Limited

Mansi Patel Company Secretary & Compliance Officer

Encl: a/a

ACE SOFTWARE EXPORTS LIMITED

Registered Office: 801 Everest Commercial Complex, Opp. Shastri Maidan, Rajkot, Gujarat, India, 360001.

CIN: L72200GJ1994PLC022781 | Tel. No.: 0281-2226097

Email ID: investorinfo@acesoftex.com | Website: https://www.acesoftex.com/

Recommendations of the Committee of Independent Directors ("IDC") of Ace Software Exports Limited ("Target Company" or "TC") under Regulation 26(7) of Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended ("SEBI SAST Regulations") in relation to the open offer to the public shareholders of the Target Company ("Open Offer") made by Amit Mansukhlal Mehta ("Acquirer") together with Vaishali Amit Mehta ("PAC").

_		y Amit Mansukhiai Mehta (" Acquirer ") together with Vaishaii Amit Mehta (" PAC ").
Sr. No.	Topic Date	Particular April 04, 2024
2.	Name of the Target Company	Ace Software Exports Limited
3.	(TC) Details of the Offer pertaining to TC	The Open Offer is being made by the Acquirer and PAC to the Public Shareholders to acquire up to 16,02,560 Equity Shares representing the entire Public Shareholding constituting 25.04% of the Emerging Voting Capital of the Target Company at a price of ₹ 35/- per Equity Share, aggregating to a total consideration of ₹ 5,60,89,600/- payable in cash in accordance with Regulation 9(1)(a) of the SEBI (SAST) Regulations.
4.	Name(s) of the acquirer and PAC with the acquirer	Acquirer: Amit Mansukhlal Mehta PAC: Vaishali Amit Mehta
5.	Name of the Manager to the offer	Vivro Financial Services Private Limited Vivro House, 11, Shashi Colony, Opp. Suvidha Shopping Center, Paldi, Ahmedabad – 380007. Gujarat. India. Tel. No.: +91 79 4040 4242 Email Id: investors@vivro.net Contact Person: Shivam Patel Website: www.vivro.net SEBI Registration No.: INM000010122 CIN: U67120GJ1996PTC029182
6.	Members of the Committee of Independent Directors	Dharamshi Vadalia (Chairman) Vimal Kalaria (Member) Pratik Dadhania (Member)
7.	IDC Member's relationship with the TC	 All IDC members are Non-Executive and Independent Directors of the Target Company. Mr. Vimal Kalaria holds 1000 equity shares of the Company. None of the members of the IDC has any contracts or any relationship with the Target Company.
8.	Trading in the Equity shares/ other securities of the TC by IDC Members	No member of the IDC has traded in any of the Equity Shares/ other securities of the Target Company during the: 1. 12 (Twelve) months preceding the date of the PA. 2. Period from the date of the PA till the date of this recommendation.
9.	IDC Member's relationship with the acquirer	None of the members of IDC has any contract/ arrangement / relationship with the Acquirer and / or with PAC.
10.	Trading in the Equity shares/ other securities of the acquirer by IDC Members	Not Applicable (As the Acquirer and PAC are individuals)
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of ₹ 35 per Equity Share is fair and reasonable in terms of the SEBI (SAST) Regulations. However, the Public Shareholders of the Target Company should independently evaluate the Open Offer and market performance of the Target Company's Equity Shares and make their own informed decisions with respect to the Open Offer.
12.	Summary of reasons for the recommendation	The members of the IDC have perused the following offer documents for recommendation on the Open Offer: 1. Public Announcement dated January 06, 2024 ("PA") 2. Detailed Public Statement published on January 12, 2024 ("DPS"), 3. Draft Letter of Offer dated January 19, 2024 ("DLoF") 4. Letter of Offer dated March 27, 2024 ("LoF") Based on the review of the offer documents, the members of the IDC have considered the following factors for making the recommendations: 1. The Acquirer intends to support the management of the Target Company in their efforts towards the sustained growth of the Target Company. 2. The Acquirer and PAC shall be classified as the promoters of the Target Company along with the existing Promoters and Promoter Group of the Target Company in accordance with SEBI (SAST) Regulations and SEBI (LODR) Regulations. 3. The Equity Shares of the Target Company are infrequently traded on BSE in terms of Regulation 2(1)(j) of the SEBI SAST Regulations. 4. The Offer Price is in accordance with 8(1) and 8(2) of the SEBI SAST Regulations.
13.	Disclosure of the Voting Pattern	The recommendations were unanimously approved by the members of IDC.
14.	Details of Independent Advisors, if any.	None
15.	Any other matter(s) to be highlighted	None

"To the best of our knowledge and belief, after making the proper enquiry, the information contained in or accompanying this statement is, in all material respect, true and correct and not misleading, whether by the omission of any information or otherwise and includes all the information required to be disclosed by the Target Company under the SEBI SAST Regulations."

For and on behalf of the Committee of Independent Directors of Ace Software Exports Limited

3d/-

Dharamshi Vadalia

Chairman- Committee of Independent Directors

Place: Rajkot Date: April 04, 2024 FRIDAY, APRIL 5, 2024 WWW.FINANCIALEXPRESS.COM 14 BACK PAGE

• 350 MILLION VIEWERS TUNE IN FOR FIRST 10 MATCHES ON DISNEY STAR

IPL smashes TV viewership records

watch-time spikes 20% from last year, show BARC data

FE BUREAU New De**l**hi. Apri**l** 4

DISNEY STAR, THE official broadcaster of the Indian Pre-mier League, logged record-breaking viewership for the first 10 matches of the 202 sheason. According to BARC data, 350 million viewers tuned in to watch the live broadcast of these matches, surpassing viewership from previous edi-tions of the tournament, even those held during the pantions of the tournament, even those held during the pandemic. The overall watch-time for the tournament was 20% higher than last year. Helped by a compelling marketing campaign and interesting programming, match ratings for the current season

Non-vegetarian thali act costlier

by 2% last month because of a 5%

increase in broiler

IT'S A BIG HIT **35.8 crore** viewers watched the IPL over the first 10 matches 22% 20% iumped 22% compared to the last edition. It has launched

last edition. It has launched seeveral new programming in-tiatives including custom high-lights and activations to collab-orate with the content creator ecosystem across platforms. It has also Introduced a special broadcast for kids-every Sunday aftermoon – Super Funday – to better serve § 12-year-olds. In a statement, Sanjog Gupta, head, sports, Disney Star,

said:"DisneyStarhas started the off last year, doubling down on fan-centred initiatives... The figures also reflect the success ngures also reflect the success of our endeavour to enhance the IPL viewing experience through broadcast and pro-gramming innovations, includ-ing HDR-enhanced 4K, interac-tive services, and multi-platform fan engage-ment."

RAJESH KURUP Mumbai, April 4

CENTRE COURT CAPITAL, a

CENTRE COURT CAPITAL, a venture capital frim backed by Sajian Jindal and founded by former ISW Sports CEO Mustafa Chouse, plans to raise about ₹550 crore for its maiden fund. The fund will invest insports technology and gaming, such as - sports, gaming studies and developers. The fund, having secured commitments of ₹200 crore from investors and athletes,

from investors and athletes

From investors and athletes, plans to launch an offshore feeder fund in GIFT City to raise capital from global investors. It would focus on early-stage opportunities with a ticket size of ₹8-24 crore, while reserving 40-50% of the

Centre Court Capital

launches ₹350-cr maiden

fund for sports, gaming

Disney Star is broadcasting the tournament across 14 feeds in 10 languages with a special feed in ISL (Indian Sign Language for deaf, hard-of-hearing, and visually impaired/fans. Not just viewership, ad vol-

Not just viewership, ad vol-umes during the first seven matches of IPL 17 also saw a spike. According to a report by TAM, ad volumes during this period grew 496 in 2024 over 2023. The report further added that the count of advertisers increased during IPL 17 over IPL 16 (2896) as did the num-ber of advertising categories (6596). E-commerce and gam-ing categories sminishined the

(65%). E-commerce and gaming categories maintained the top position throughout the first 7 matches of IPL 17.

The TAM report said 30 new categories and 55 new brands were advertised in the first seven matches of IPL 17 compared to the same number of matches in IPL 16. Patel Food Products led the new brands parade, followed by Airtel Xstream Fiber.

Sign language redefines IPL viewing for deaf fans



In a first for live sports broadcasting, Star Sports has added sign language interpretation to its IPL feed

VENKATA KR**I**SHNA B

SECONDS AFTER VIRAT Kohli is dismissed during the Royal Challengers Bangalore match

is dismissed during the Royal Challengers Bangalore match against Lucknow Super Giants on April 2, KinjalShah's expression on the bottom right-hand corner of the television screen catches the atmosphere at the Mchinnaswamy Stadium. With her right index finger, she draws an imaginary circle, indicating the stadium, before making a screaming expression. The next moment, both her hands come down together, palms down, indicating the drap in noise levels. Then, it's finger on the lips to indicate the total slence at the stadium. In a matter of seconds, the deaf community experiences what a pin-drop silence feels like in a packed arena of nearly 35,000. This IPL, Star Sports 3 has joined hands (StH), a Mumbah-based broadcast company, to add Indian Stein Inausoe interme-

Hands (ISH), a Mumbal-basen broadcast company, to add Indian Sign Language interpre-tation to its feed. While the Hindi language commentary is on, a sign language interpreter provides alive commentary tar-geted at the 63 million deaf peo-

This IPL, Star Sports 3 has joined hands with India joined hands with India Signing Hands (ISH), a Mumbai-based broadcast company, to add Indian Sign Language interpretation to its feed

ple in India, many of them cricket enthusiasts. This is the first known instance of sign language being used for live commentary for any sports in India. Watching the sign language interpreter on television from his residence at Mumbai's Malabar Hill, Alok Kejriwal, founder & CEO of India Signing Hands, tells The Indian Express that it's the first time in his 50 years of watching cricket that he has felt included. "Earlier, when a cricketer walked into the stadium, it didn't feel too different from when any person entire the modern of the stadium, it didn't feel too different from when any person the stadium, it didn't feel too different from when any person when the same when the same when the same when the same when bhoni or Kohli walked into a stadium orwhen they were dismissed. Now I can feel the noise when they walk

in or the silence at the ground. Moreover, I'm able to watch it with everyone. These are new experiences...to watch it with friends and family. We sat as

FINANCIAL EXPRESS

experiences...10 watcn it with riends and family. We sat as equals, says the 62-year-old. Minutes before the match begins, the interpreter builds the excellement by starting with the countdown before the flist ball is bowled. From there on, they translate every word of the lindi commentary, providing insights that the deaf commu-nity probably never experi-enced during acricket match. What stands out in their interpretation are the expres-sions that convey different emotions. For example, income of a thrilling lose call that is referred to the third umpire, the interpreters refer to the heart beat, indicating the ten-sion in the air.

"When it comes to sign language, expressions are like grammar," says Mansi Dharmaral Shah, an interpreter for the IPL. "Without the expressions, the deaf community will not experience the entire picture. It will look flat and the language will remain incomplete, it will only resemble a gesture. So expressions are important," she adds.

Veg thali cheaper in March, non-veg becomes costlier

THE COST OF household vegetarian meat prices, data from Crisil thali saw a marginal sequential decline in March, due to a 2% fall in tomato prices compared to the previous month. reports Sandip Das.

showed. The veg thali prices rose 7% each last month on year because of costlier onion tomato and potato. The non-veg thali prices dropped by 7% last month because of a sharp 16% fall in

poultry meat price

Food plate cost (₹) ● Non-veg thali ● Veg thali 59.2 • • • • • • • • Mar '23 • • • • • 25.5 58.9 ••••• Apr '23 •••• 25.4 59.9 • • • • • • • • • May '23 • • • • • 25.5 60.5 ••••• Jun '23 •••• 26.7 60.7 Sept '23 28.1 Sept '23 28 58.6 ••••• Oct '23 ••• • 27.7 60.4 •••••• Nov '23 •••• 30.5 56.4 • • • • • • • • • Dec '23 • • • • • • • 29.7 52.0 •••••• Jan '24 ••••• 28 54.0 •••••• Feb '24 ••••• **27.4** 54.9 ••••• Mar '24E••••• 27.3 - (7%) y-o-y | (2%) m-o-m Change (7%) y-o-y | 1% m-o-m --

✓ YES BANK

NOTICE Transfer of Equity Shares of the Bank to Investor Education and Protection Fund (IEPF) Authority

Notice is hereby given that pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013 (the Act) read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended, the Equity Shares of the Company ("Bank") in respect of which dividend has remained unclaimed or unpaid for a period of seven consecutive ears are required to be transfer by the Bank to the demat account of the IEPF

The Bank has sent communications to the concerned shareholders whose shares are liable to be transfer to the IEPF Authority at their registered email IDs or latest available address, advising them to claim their unclaimed dividends. The Bank has uploaded details of the concerned shareholders whose shares are due for transfer to the IEPF Authority on its website www.yesbank.in. Shareholders are requested to refer to the website to verify the details of unclaimed dividends and the shares which are liable to be transfer to the IEPF Authority.

The concerned shareholder(s) holding shares in physical form and whose shares are liable to be transfer to the IEPF Authority, may note that upon transfer of shares to IEPF Authority, the original share certificate(s) which are registered in shares to IEPF Authority, the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. In case of shares were held in dematerialized form, to the extent of shares liable to be transfer, shall be debited from the shareholders' account. In case the concerned shareholders do not daim their unclaimed dividends by July 5, 2024, the Bank shall transfer the shares to the IEPF Authority in compliance of the said the Rules without any further notice to the shareholders and no liability shall lie nst the Bank in respect of the shares so transferred.

The shareholders may note that upon transfer of the shares to IEPF Authority, including all benefits accruing on such shares, if any, the same can be claimed only from the IEPF Authority by submitting an online application to the IEPF Authority in Form IEPF–5 available on the website www.iepf.gov.in along with fee

For any queries in respect of the above matter, shareholders may contact KFin Technologies Limited, the Registrar & Transfer Agent of the Bank to, Ms. Shobha Anand, Deputy Vice President at Unit: YES BANK Limited, Karvy Selenium Tower owli, Financial District, Nanakramguda, Hyderabad - 500032, Tel: +91- 40 - 6716 2222 e-mail ID: einward.ris@kfinto

ACE SOFTWARE EXPORTS LIMITED ed Office: 801 Everest Commercial Complex, Opp. Shastri Maidan, Rajkot, Gujarat, India, 360001 CIN: L72200GJ1994PLC022781 | Tel. No.: 0281-2226097

"We have seen a tremen-dous rise in both public and private investment in sports, which has more than quadru-pled since 2020. As a result, we're seeing an acceleration in the number of startups that are building from India for India and the world." Ghouse said.

fund for follow-on investments, it said in a statement.
The VC fund, founded by
Ghouse and Alok Samtaney,
former investment director
with TVS Capital and Sabre
Partners, has the Sajjan Jindal
Family Trust as anchor
investor. Further, Small
Industries Development
Bank of India, Premjilnvest,
USK Capital, GMR Sports and
SG Sports are other investors.
"We have seen a tremendous rise in both public and

ecommendations of the Committee of Independent Directors ("IDC") of Ace Software Exports Limited ("Target Co-"TC") under Regulation 26(7) of Securities and Exchange Board of India (Sotstantial Acquisition of Shares and Explaidions, 2011, as amended ("SPBIS ASX Regulations") in relation to the open offer to the public hardworks.

Sr. No.	Topic	Particular
1.	Date	April 04, 2024
2.	Name of the Target Company (TC)	Ace Software Exports Limited
3.	Details of the Offer pertaining to TC	The Open Offer is being mode by the Acquirer and PAC to the Public Shareholders to acquire up to 16.02.566 (Equify Shares representing the entire Public Shareholding constituting 25.04% of the Emerging Voting Capital of the Target Company at a price of 3.5° per Equify Share, appreciation to a total consideration of ₹.5.68.8600°, payable in cash in accordance with Regulation 9(1)(a) of the SSEI (ASAT) Regulations.
4.	Name(s) of the acquirer and PAC with the acquirer	Acquirer: Amit Mansukhlal Mehta PAC: Vaishali Amit Mehta
5.	Name of the Manager to the offer	Vivor Financial Services Private Limited Vivor Houses, 11, Stasht Colony, Ogs Swidtha Shopping Center, Paldi, Ahmedatad – 380007. Gujart. India. Tel. No. ≃ 1917 3404 04242 Email Id: Investors@/wivo.net Contact Person. Shivam Patel. Website: www.vivor.net SEBI Registration Nor. Imm000010122 CIMI-UG1720611996PT0029182
6.	Members of the Committee of Independent Directors	Dharamshi Vadalia (Chairman) Vimal Kalaria (Member) Pratik Dadhania (Member)
7.	IDC Member's relationship with the TC	All IDC members are Non-Executive and Independent Directors of the Target Company. Mr. Vimal Kalaria holds 1000 equity shares of the Company. None of the members of the IDC has any contracts or any relationship with the Target Company.
8.	Trading in the Equity shares/ other securities of the TC by IDC Members	No member of the IDIC has traded in any of the Equity Shares/ other securities of the Target Company during the: 1. 12 (Twelve) months preceding the date of the PA. 2. Period from the date of the PA till the date of this recommendation.
9.	IDC Member's relationship with the acquirer	None of the members of IDC has any contract/ arrangement / relationship with the Acquirer and / or with PAC.
10.	Trading in the Equity shares/ other securities of the acquirer by IDC Members	Not Applicable (As the Acquirer and PAC are individuals)
11.	Recommendation on the Open offcr, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Ofter Price of ₹ 35 per Equity Share is fair and reasonable in terms of the SEBI (SAST) Regulations. However, the Public Shareholders of the Target Company should independently evaluate the Open Offer and marriet performance of the Target Company's Equity Shares and make their own information decisions with respect to the Open Offer
12.	Summary of reasons for the recommendation	The members of the IDC have persond the following offer documents for recommendation on the Open Offer. 1. Public Announcement dated January 98, 2024 (*PR) 2. Detailed Public Statement published on January 12, 2024 (*DRS*). 3. Draft Letter of Offer dated January 19, 2024 (*DRS*) 3. Draft Letter of Offer dated January 19, 2024 (*DRS*) Based on the review of the offer documents, the members of the IDC have considered the following placers for making the recommendations: 1. The Acquirer intends to support the management of the Target Company in their efforts lowards the sustained growth of the Target Company in their efforts lowards the sustained growth of the Target Company in accordance with SEB (ISAST) Regulations and SEB ((DDR) Regulations of SEB (LODR) Regulations of Target Company of the Target Company of the Target Company in accordance with SEB (ISAST) Regulations and SEB (LODR) Regulations of SEB (LODR) Regulation is a constant of the Target Company of the Target Company in accordance with SEB (ISAST) Regulations and SEB (LODR) Regulations of SEB (LODR) Regulation is accounted with the Isaget Company are infereduced in SEB is SEB SAST Regulations and SEB (LODR) Regulations of SEB (LODR) Regulations is accounted with SEB (LODR) and SEB (SAST Regulations).
13.	Disclosure of the Voting Pattern	The recommendations were unanimously approved by the members of IDC.
14.	Details of Independent Advisors, if any.	None
15.	Any other matter(s) to be	None

financialexp.epapr.in

DHINOOR PULP & PAPER PRIVATE LIMITED (IN LIQUIDA' CIN: UT4999WB2008PTC126964 LIQUIDATOR - CVR Krishnaswami (Reg. No. IBBI/IPA-001/IP-P01302/2018-19/12217) ce is given to the public in general that the following Asset Lot of KOP (Reg. No. Depur not that the following Asset Lot of KOP lotics is given to the public in general that the following Asset Lot of KOP PULP & PAPER PRIVATE LIMITED (in Liquidation) ("Corporate D in liquidation vide order of Hor/ble NCLT dated 91.07.2019) is to the public of the p ate and time of e-Auction April 29, 202 ast Date for Submission of Bid April 19, 202

	(Under Regulation 6 of the Insolv (Insolvency Resolution Process for	RM A VOUNCEMENT rency and Bankruptoy Board of India Corporate Persons) Regulations, 2016)
FOF		IMBLO DRYDOCKS PRIVATE LIMITED
_		PARTICULARS
1,	Name of Corporate Debtor (CD) Date of incorporation of corporate debtor	TIMBLO DRYDOCKS PRIVATE LIMITED 28/04/1973
3.	Authority under which corporate debtor	28/04/19/3 Registrar of Companies – Goa
0.	is incorporated/registered	Registrar or Companies – Goa
4.	Corporate Identity No. of corporate debtor	U63032GA1973PTC000164
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	Regd Address: Subhash Timblo Bhawan, Margao, Goa - 403601
6.	Insolvency commencement date in respect of Corporate Debtor	28/03/2024 (The Order received by IRP on 02/04/2024)
7.	Estimated date of closure of insolvency resolution process	24/09/2024 (Being 180 days from 28/03/2024)
8.	Name and Registration Number of the insolvency professional acting as interm resolution professional	Name: Mr. Prashant Jain Registration No. IBBNPN-001/IP-P01368/2018-2019/12131
9.	Address and e-mail of the Interim Resolution Professional, as registered with the Board	Regd Add: A501, Shami Heights, Plot No. 2,3,98/10, Sector 11, Kopekhame, Thore, Navi Mumbai-400709 Email id: ippreshantjain@gmail.com
10.	Address and e-mail to be used for correspondence with the interim resolution professional	Cio SSARVI Resolution Services LLP Add: B-610, BSEL Techpark, Sector 30A, Opp. Vashir Railway Station, Navi Mumbal – 400703 Website: www.ssanvi.com/ Email: cinc firstiodhydodys@comsil.com
11.	Last date for submission of claims	16/04/2024 (Being 14 days from 02/04/2024)
12.	Classes of creditors, if any, under clause (b) of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional	NA.
13.	Names of Insolvency Professionals identified to act as Authorised Representative of crecitors in a class (Three names for each class)	NA .
14,	Relevant Forms and Details of authorized representatives are available at	https://www.ibbi.gov.infhome/downloads NA

Registration No.: IBBI/IPA-001/IP-P01388/2018-2019/12131 Interim Resolution Professional in the matter of M/s, TIMBLO DRYDOCKS PRIVATE LIMITED

Place: Mumbai Date: April 05, 2024



राहुल व स्टालिन 'इंडिया' गठबंधन की रैली में होंगे शामिल

पेगासस एसेट रीकंस्ट्रक्शन प्रा.लि. ss-ss, sवी जीवल, प्रते देस सरस स्वास्य व्यास्ट, पुच्यां-acco: वृग्गाव ने : c22-61864700 है-नेल : syskippegasus-arc.com पुजासल : www

कुलकर्णी और न्यायमूर्ति फिरदौस मुंबई, 4 अग्रील (भाषा)।

वंबंद्ध हाई कोर्ट ने महाराष्ट्र सरकार को भाषित हो।

के भरकार लगाते हुए गुरुवार को कहा कि यह कुछ मुद्दों पर त्वरित फिरामें से सरकार की देरी स्वीकार्य महीं है।

कहा कि यह कुछ मुद्दों पर त्वरित फिरामें ते हैं।

कहा कि यह कुछ मुद्दों पर त्वरित फिरामें ते हैं।

कहा कि यह कुछ मुद्दों पर त्वरित किया से किस की स्वीवस्था को आधीरक लाभ देने के संबंध में निर्णय लेने की क्षमात स्वति है। सामकर मुख्यमंत्री के लोने में देरी कर रही है। न्यायमूर्ति जीएस लिए यह एक छोटा सा मुद्दा है। पीठ दिवंगत

भेजर अनुज सुद की विधवा आकृति सुद द्वारा दायर गांचिका पर सुनवाई कर रही थी। याचिका में 2000 और 2019 में जारी दो सरकारी प्रस्तावों के तहन पूर्व सैनिकों के लिए (मींद्रिक) लाभ का अनुरोध किया गया है। अचलत ने मामले की अगली सुनवाई की तिथि 10 अप्रैल तब की और कहा कि उसे उम्मीद है कि सरकार तब तक कोई निर्णय ले

लेगी। मंत्रर सुद दो मई, 2020 को उस वक्त शहीद हो गए थे जब वह बंधक बनाए गए लोगों को आतंकवादियों के चंगुल से बचा रहे थे। उन्हें मरणोपरांत शौर्य चक्र से सम्मानित किया गया था। महाराष्ट्र सरकार के अनुसार, केवल वे लोग इस राहत और भन्ने के पात्र हैं

जिनका जन्म महाराष्ट्र में हुआ है या जो लगाता 15 साल तक राज्य में रहे हैं

चेन्नई, ४ अप्रैल (भाषा)।

तिमलानाडु में सत्तारूढ़ द्रविड मुनेत्र कषमाम ने गुरुवार को कहा कि पार्टी अध्यक्ष एवं तिमलानाडु के मुख्यमंत्री एम के स्टालिन और कांग्रेस नेता राहुल गांधी 12 अप्रैल को कोयंबदूर में विपक्षी गठबंधन 'इंडिया' की

एक रैली में शामिल होंगे। तमिलनाडु की 39 एक रहा में शामल होगा तामलानाडु को 39 लोकसाभा सीट पर फह ही उरण में 19 अप्रैल को मतदान होगा। इमुक की यहाँ जारी एक विज्ञिस में कहा गया है कि दोनों नेता रैली में शामिल होंगे और विपक्षी गठबंधन इंडिया के उम्मीदवारों के लिए समर्थन मांगेंगे। कीवंबदूर के चेट्टीपलायम क्षेत्र में यह रैली होगी।

जनता दल (एकी) ने जारी की प्रमुख प्रचारकों की सची

जनसत्ता ब्यूरो नई दिल्ली, ४ अप्रैल I

प्रचारक सामित होगी किहार की 40 लोकसभा सीट हैं। कुछ दिन पहले जद (एकी) दोबारा राष्ट्रीय जनतांत्रिक गठबंधन में शामिल हुई है। प्रमुख प्रचारकों में संजय झा, ह। प्रमुख प्रचारका म सजय झा, रामनाथ ठाकुर, उमेश कुशवाहा, श्रवाण कुमार, मनोरमा सिंह, राजीव रंजन, बिजॅंड यादव, विजय कुमार चौधरी समेत पार्टी के कई और नेताओं को शामिल किया गया है। राजग के सहयोगी दलों में सबसे बड़ी पार्टी के तौर पर जद (एकी) के 16 प्रत्याशियों को चुनाव मैदान में उतारा जा रहा है।

भाजपा उम्मीदवार के सुरेंद्रन, सुरेश गोपी ने किया नामांकन दाखिल

त्रिशूर, ४ अप्रैल (भाषा)।

भारतीय जनता पार्टी (भाजपा) की केरल इकाई के प्रमुख के सुरेंद्रन और अभिनेता से नेता बने सुरेंश गोपी ने गुरुवार को नती बन सुरश गोपा न गुरुवार का क्रमशः वायनाड और त्रिश्र्र लोकसभा सीट से अपने अपने नामांकन वाखिल किए। जब गोपी अपना नामांकन दाखिल करने गए तो उनके साथ स्थानीय पार्टी नेता तो उनके प्रायः स्थानीय पार्टी नेता मीजूद थे, वहीं सुरद्रिन के साथ केंद्रीय महिला एवं बाल विकास मंत्री स्मृति इंटर्गा के क्रांध्र महिला एवं बाल विकास मंत्री स्मृति इंट्र्गा केंद्रीय महिला अपने लिए जिला करने के लिए जिला करने के लिए पार्टी केंद्रीय के साथ वायनाह में एक रोड शो किया पाताड़ी निर्वाचन केंद्र में सुर्वन का मुकावला मीजून कांद्रीय साम्यत्र मुकावला मीजून कांद्रीय साम्यत्र मार्चीय कार्युनिस्ट मार्ची शाम से होगा। त्रिश्चर लोकसभा संदेश से भाजया उम्मीदत्वार गोणी अपना नामांकन दाखिला करने के लिए पार्टी कार्युक्तीय मीजित करने के लिए पार्टी कार्युक्तीय कार्युक्त कार्युक्त साम्यक्ति के साथ जिला कलंकर लोकसभा सार्टी साथ जिला कलंक्टर कार्यालय पहुँचे। पलक्कड़ लोकसभा सीट से भाजपा के नेतृत्व वाले राष्ट्रीय जनतांत्रिक गठबंधन (राजग) के उम्मीदवार सी कृष्णकुमार ने भी अपना नामांकन दाखिल किया।

राजीव चंद्रशेखर, केसी वेणुगोपाल ने लोकसभा चुनाव के लिए नामांकन दाखिल किया

तिरुवनंतपुरम्, ४ अप्रैल (भाषा)।

भारतीय जनता पार्टी (भाजपा) के उम्मीदवार व केंद्रीय मंत्री राजीव चंद्रशेखर और कांग्रेस

राजीव चंद्रसंख्य और कांग्रेस महासचिव कंसी वेणुगोपाल सहित अन्य उम्मीदावारों ने लोकसभा चुनाव के लिए गुरुवार को केरल से अपना नामांकन पाडिज्य किया तिरुवनंतपुरम लोकसभा सीट से नामां कर से प्राच्य नामांकन पाडिज्य किया नामांकन पाडिज्य किया उनके साथ अपना नामांकन पाडिज्ञ किया अपने साथ अपना नामांकन पाडिज्ञ किया नामांकन वार्याख्य किया मंत्री एस जयमंकर और भारतीय जनता पाटी (भाजपा) के अन्य वार्षिक तो भी मीजद थे उनका मनकाला कांग्रेस मनकाला कांग्रेस मनकाला कांग्रेस मनकाला कांग्रेस (माजपा) के अन्य पाएड नेता मा मौजूद थे। उनका मुकाबला कांग्रेस के वरिष्ठ नेता व मौजूदा सांसद शशि थरूर और माकपा के दिग्गज नेता पन्नियन रवींद्रन से है। इससे पहले थरूर ने तिरुवनंतपरम से लगातार चौथी बार जीत ब्रासिल करने का भरोसा जताया था।

प्रपत्र सं.यूआरसी–2

े आयाम-XXI के वागा I के तहत पैतीकरण के में गीटिस देने वाला विवास अधिनियम, XXI को वारा उस, (क्षी) और कोमी (ऐसीकरण के लिए अधिकृत) नियम, 2014 के नियम 4 (१) के अनुकर्ती।

रखनार, परदर्शन, रातानंद राजानंद अध्यान से अध्यान के स्वान के स्वान करना । इसी प्रशासन करना । इसी प्रशासन विकास करना । इसी प्रशासन के इसी प्रशासन करना । इसी प्रशासन करना । इसी प्रशासन के इसी प्रशासन करना । इसी प्रशासन के इसी इसी प्रशासन के इसी प्रशासन के

अपन1987PLC00 प्लॉटन सी–३, सैक्ट ई—गेल:noid फोन:0120-29

मांग सूचना "वित्तीय आस्तियों का प्रतिभूतिकरण और पुनर्गठन तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम, 2002 (2002 का स 50) की धारा 13(2) के अधीन

पर वो अंदरातों माश्रा 20.4.2004 को बने विना होना दिनाईक को मुनुनिवार दर पर प्रविध्य । प्रकार के पान देवा हैं । प्रवाधिक परेंद्र ने प्रंत प्रकार की प्रकार की कार प्रवाधकों, दिना प्रवाधिक पर के पाने प्रवाधिक परेंद्र ने प्रवाधिक हों के प्रवाधिक हों के की कार प्रवाधकों, दिना प्रवाधिक पर के पाने एकि -2012 की प्रवाधिक हों के प्रवाधिक हों के प्रवाधिक की प्रवाधिक के प्रवाधिक की पाने की प्रवाधिक की पाने प्रवाधिक की की प्रवाधिक की की प्रवाधिक की की प्रवाधिक की प्रवाधिक की प्रवाधिक की की की प्रवाधिक की प्रवाधिक की की प्रवाधिक की की प्रवाधिक की की प्रवाधिक की प्रवाधिक की की की की की की की प्रवाधिक की की की की की की की की की प्रवाधिक की की की



THE RAMARAJU SURGICAL COTTON MILLS LIMITED

of Otters").
Registered Office: Post Box No. 2, 119/120, PA.C., Ramasamy Raja Salai, Rajposlayam – 626117 Tamil Nadu, India.
Tetephone: -91-1593-25904 [Email: riscim/paramedes.com | Website www.ramarajusargical.com
Contact Person: P Mightusums: Company Secretary and Complexo Officer | Email: multihormer_pigramcotex.com
Corporate Identification Number: L171117111339PL0002302

Copprate Identification Number: LY17111173997-L0022002

OUR PROMOTER: PR VENKETRAMA RAD

ISSUE OF UP TO 18.17.227 FULLY PAID-UP COULTY SHARES WITH A FACE VALUE OF 910 EARLY FINGERTS EQUITY SHARES*) FOR CASH AT A PRICE OF 920 EACH INCLUDING A SHARE PREMIUM OF 914 PER BIRDITS COUNTY SHARE SHOULT SHARE PROMOUNT UP TO 93.707.14 LAMPS* ON A RIGHTS BASIS TO THE EXISTING EQUITY SHARED COUNTY SHARED

BASIS OF ALLOTMENT The Board of Directors of our Company thanks all Investors for their response to the base, which opened for subscription on Fristay, March 15, 2024, and closed on Fristay, March 22, 2024, and the last date for On Market Renuciation of Rights Estitionness was Monday, March 16, 2024. Out of the bate 624 Applications for 624, 78-428. Hights Equily States 27.7 Applications for 20, 213 Rights Equily States were rejected due to bethical exercisions as disclosed in the Letter of URE in the Total number of valid Applications received was 417 for 24.58,293 Rights Equily States, which was 155.29% of the number of Rights Equily States, should not be seen of valid Applications received was 417 for 24.58,293 Rights Equily States, which was 155.29% of the number of Rights Equily States, should not be seen of valid Applications and the English and States (Authorn the Institute on March 20, 2023 each in consolation with Metopolation Stock Exchange of hold activation of March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023 each of States (Authorn the Institute on March 20, 2023

Category	No. of valid applications received	No. of Rights Equity Shares accepted and allotted against Entitlements (A)	No. of Rights Equity Shares accepted and allotted against Additional Rights Equity Shares applied (B)	Total Rights Equity Shares accepted and allotted (A+B)	
Shareholders	411	12,18,399	5,91,888	18,10,287	
Renouncees	6	6,940		6,940	
Total	417	12,25,339	5,91,888	18,17,227	
2. Information rega	arding total Applications rece	ived:	307200000	15.1 19.50 (S.C.) 10.00 (S.C.)	
Applications Descriped Equity Charge Spalled for Equity Charge elletted					

Catanani	Applications	Received	Equity Shares Applied for			Equity Shares allotted		
Category	Number	%	Number	Value (Rs.)	%	Number	Value (Rs.)	%
Shareholders	411	98.56	24,51,326	50,00,70,504	99.72	18.10,287	36,92,98,548	99.62
Renouncees	6	1.44	6,967	14,21,268	0.28	6,940	14,15,760	0.38
Total	417	100.00	24.58,293	50,14,91,772	100.00	18,17,227	37,07,14,308	100.00

2023, the request for extinguishment of Rights Entitlements has been sent to NSDL & CDSL on April 3, 2024.

NVESTORS MAY PLEASE NOTE THAT THE EQUITY SHARES CAN BE TRADED ON THE STOCK EXCHANGE ONLY IN DEMATERIALIZED FORM

UNIONA UNIO-WIND SPECIFIC, All Capitalised terms used herein shall have the same meaning ascribed to such terms in the Letter of Offer.


THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES OR THE CO
BUSINESS PROSPECTS.

LEAD MANAGER TO THE ISSUE REGISTRAR TO THE ISSUE COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER VIVRO THE RAMARKING The Ramaraju Surgical Cotton Mills Limited The Hamarajis Surgicas Octoon Miss Limited
Mr. P Muthiakumar,
Post Box No. 2, 119/120, P.A. C. Ramasamy Raja
Salai, Rajapalayam – 628117 Tamii Nadu, India
Telephone: +91-4553-235904
E-mail: rscm@ramcotex.com
Websitie: www.ramaraissumical.com

Wine Filaceta's Services Private Limited
Wine Filaceta's Services Private Limited
Wine Filaceta's The Services Limited
Wine Filaceta's Company of Company of

Place: Riskondavam Dischalmer, Our Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other classis and has filled a Lattier of Offer with the Securities and Exchange Beard of India and Stock Exchange. The American was subject to the Company of the Comp





00 0

Place: Rajkot Date: April 04, 2024

હાઈવે પર વાહનચાલકોને હેરાન કરી રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદને પગલે એસીબીની સફળ ટ્રેપ

'મલાઈ' મોંઘી પડીઃ ૩ ખાખીધારી બસ્સો રૂપરડીની 'લાંચ'માં ઝડપાચા

અધિકારી, પંચના માણસો ભંગારના ટેમ્પોમાં બેસી ગયાઃ સોએક કિલોમીટર રસ્તા પર ફર્ચા પછી અંતે લાંચીયા કર્મચારીઓ ભેટ્યા અને આબાદ દબોચ્યા

રાજકોટઃ અમુક સરકારી બાબુઓ પોતે જે સ્થાન પર ફરજે બજાવતાં હોય તેના માટે કાયદેસરનો મસમોટો સરકારી પગાર મેળવતા હોવા છતાં ઉપરની કમાણી વધારાની મલાઇ તારવવા માટે મથતાં રહેતાં હોય છે. ગમે તેમ કરીને તેઓ વધારાના રૂપિયા ગજવામાં નાખે પછી જ તેને લોકોના કામ કરવાન સઝત હોય છે. તો પોલીસ કર્મચારીઓ. હોમગાર્ડ જવાનો પણ અલગ અલગ રીતે આ પ્રકારની ઉપલી કમાણી કરતાં હોય છે. હાઇવે પર કરજ બજાવનારા માટે વાહન ચાલકો મુખ્ય ટારગેટ હોય છે. ચેકીંગના નામે આવા કર્મચારીઓ જે તે વાહનને આંતરી એકાદ કાગળ પણ ઓછો હોય તો બસ્સોથી માંડી પાંચ દસંહજાર સુધીનો વહીવટ કરી રોકડી કરી લેતાં હોય છે.આ લાંચીયા કર્મચારીઓને પકડી લેવા માટે એસીબીએ ખાસ ડ્રાઇવ રાખી હતી. જેમાં એસીબીના અધિકારી પંચને આથે રાખી ભંગાર ભરેલા એક ટેમ્પોમાં બેસી ગયા હતાં અને સો

કિલોમીટર સુધી ટેમ્પો ફેરવ્યા બાદ આ ટીમે ત્રણ લાંચીયા કર્મીને બસ્સો ૩૫રડીની લાંચ લેતા દબોચી લીધા હતાં.

માત્ર બસ્સોની લાંચમાં નોકરીનો માભો ગાભો કરી નાખનારા આ ત્રણેયએ અત્યાર સુધીમાં કેટલા વાહનચાલકોને ખંખેરી લીધા હશે તે કહેવું મુશ્કેલ છે. વિગતો પર નજર કરીએ તો અમદાવાદ અને સરેન્દ્રન ગર જિલ્લામાંથી આવતા પેસેન્જર વાહન તેમજ માલસામાન લઈને આવતા વાહન ચાલકો પાસેથી રિંગ રોડ ઉપર પોલીસવાળા બસ્સોથી માંડી પાંચ હજાર રૂપિયા પડાવતા હોવાની કરિયાદો એમીબીને મળી હતી. જેના આધારે એસીબીની ટીમ ટેમ્પામાં ભંગારનો સામાન લઈને નીકળી હતી. લગભગ ૧૦૦ કિલોમીટર દૂર સુરેન્દ્રનગરના પાણશીરા સુધી જઈને ટીમ પાછી આવી હતી અને ૧૯ કલાકની જહેમત બાદ વટવા ગામડી ગામ ૩ રસ્તા પાસેથી બે પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ જવાનને રૂપિયા બસ્સોની લાંચ



લેતા ઝડપી લીધા હતા. અમદાવાદ અને સુરેન્દ્રનગરની આસપાસથી આવતા-જતા वाहनवालकोने रोहीने हागणो जताववानं કહીને તેમજ કેસ કરીને વાહન ડિટેઈન કરવાની ધમકી આપીને પોલીસવાળા રૂ.૨૦૦ થી ૫ હજાર પડાવતા હોવાની ફરિયાદો એસીબીના અધિકારીને મળી હતી.

આ ફરિયાદને આઘારે એસીબીના પીઆઈ ડી.બી.મહેતાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં તેઓ અને બીજા પોલીસ કર્મચારી હતા. જ્યારે પંચ પણ સાથે રખાયા હતા. આ ટીમે એક ટેમ્પો સાથે રાખ્યો હતો અને તેમાં ભંગારનો સામાન મુકી દીધો હતો. જેમાં એક પાંચ અને બે પોલીસ કર્મચારીને બેસાડી દેવાયા હતા. જ્યારે અન્ય પોલીસ કર્મચારીઓ સરકારી ગાડી અને ખાનગી ગાડીમાં નીકળ્યા હતા. ત્યારબાદ બપોરે એસીબીની ટીમ શાહીબાગથી નીકળીને રિંગ રોડ પર પહોંચી હતી. આંટા ફેરા કર્યા પરંતુ કોઈ પોલીસ કર્મચારીએ ટેમ્પો રોક્યો ન હતો

જેથી છોટા હાથી લઈને એસીબીની ટીમ અમદાવાદ જિલ્લામાં પહોંચી હતી,

લગભગ ૮૦ કિલોમીટર સુઘી અમદાવાદ જિલ્લાની હદમાં ફર્યા બાદ ટીમ સુરેન્દ્રન ગરના પાણશીરા સધી એટલે કે ૧૦૦ કિલો મીટર દૂર ગઈ હતી અને ત્યાંથી પાછી આવી હતી. સવારે અગિયારેક વાગ્યે ટીમ એસપી રિંગ રોડ ઉપર વટવા ગામડી ત્રણ રસ્તા પહોંચી ત્યારે ત્યાં વટવા પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન લઈને ઉભેલા ત્રણ પોલીસ કર્મચારીએ ટેમ્પાને રોકયો હતો. આ ત્રણ

પોલીસ કર્મચારીમાં વટવા પોલીસ કોન્સ્ટેબલ

નવીનચંદ્ર ડામોર, કોન્સ્ટેબલ અશ્વિનકુમાર

બલાત અને હોમગાર્ડ જવાન બળદેવ ચૂન ારાએ છોટા હાથીના ડાઈવર પાસે કાગળો માંગ્યા હતા અને ખોટી રીતે હેરાન નહીં કરવા માટે રૂ.૨૦૦ની લાંચ માંગી હતી.

છોટા હાથીના ડ્રાઈવરે તેમને પૈસા આપતાંની સાથે જ એસીબીની ટીમે ત્રણેયને ઝડપી લીધા હતા. એકપણ કાગળ ઓછ હોય તો વાહન ડિટેન કરી આરટીઓનો મેમો આપવાની ઘમકી આપતા હતા એસીબીના અધિકારીઓનું કહેવું છે કે રિંગ રોડ ઉપર પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને રોકીને કાગળો માંગે છે. જો કે એક પણ કાગળ ઓછું હોય એટલે વાહન ડિટેઈન કરીને આરટીઓનો મેમો આપવાની ધમકી આપતા હતા. છેલા કેટલાક દિવસોથી પોલીસ હેરાન કરતી હોવાની કરિયાદો એસીબીને મળી હતી જેના આધારે છટકું ગોઠવવામાં આવવામાં સફળતા મળી હતી. લાંચીયા કર્મચારીઓને को रीते कोबीजीची टीमे करपी लीधा तेनी ચર્ચા રાજ્યભરમાં થઇ રહી છે.

PSI અને લોક રક્ષક દળની ભરતીના કોર્મ ભરવાનો પ્રારંભ

રાજકોટ તા.૪ રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં પીએસઆઇ, લોકરક્ષક, બિન હથિયારઘારી પોલીસ તા.૩૦મી એપ્રિલ કોંસ્ટેબલ, હથિયારઘારી પોલીસ કુર્ધી ઉમેદવારો કરી ભરતી કરવામાં આવનાર છે.૧૨ હજાર શકશે રજિસ્ટ્રેશન ૪૭૨ જઆઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ તરફથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનારી છે. ત્યારે આજથી ૩૦ એપ્રિલ સુધી ઉમેદવાર ઘઉંઅજ વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.

વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પીએસઆઇ માટે લઘુતમ ૨૧ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ ૧૮ વર્ષ અને મહત્તમ ૩૩ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ઘોરણ ૧૨ પાસ અથવા હાયર સેક્નડરી પરીક્ષા અથવા તો ઘોરણ ૧૨ પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. ૩૦ એપ્રિલ સુધી ઘઉંઅજની વેબસાઈટ પર ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ તમામ ટ્રેડર માટે ૧૦૦ સ્ૂપિયા પરીક્ષા અને બેંક ચાર્જિસ ચકવવાના રહેશે. પીએસઆઇ કક્ષામાં ફ્રિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. જ્યારે લોકરક્ષકમાં ફ્રિઝિકલ ટેસ્ટ અને ખઈચ પરીક્ષા લેવામાં આવશે. પીએસઆઇ કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પછાશે.

રાજકોટમાં રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવા આશાપરાનાસોગંદખાતા ૩૫૦ક્ષત્રિયયુવાન

જો ઉમેદવાર નહિ બદલે તો પક્ષની વિરૂધ્ધ ૧૦૦ ટકા મતદાન કરવાની પ્રતિज्ञा

રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ડરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલ આંદોલન માં ગઈકાલે પ્રથમ તબક્કાની મંત્રણા પડી ભાંગ્યા બાદ આજે સાંજે રાજકોટનાં આશાપરા મંદિર ખાતે ૩૫૦ જેટલા ક્ષત્રિય યુવાનોએ એકઠા થશે. મહત્ત્વનું છે કે, આ ક્ષત્રિય યુવાનોએ જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય . તો ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કરાવવાનામાં આશાપરાની હાજરીમાં સોગંદ ખાઘા છે.ક્ષત્રિય યુવાનોએ પ્રતિજ્ઞા લીધી છે કે, હું પ્રતિજ્ઞાલઉં છું કે, માં આશાપરાના સાનિઘ્યમાં માં આશાપુરાની સોગંદ ખાઉં છું કે, ક્ષત્રિયે સમાજની બહેન-દીકરીઓ માટે. તેમના

સ્વમાન માટે મારા સમાજે જે માગણી મકી છે. જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે ૧૮ વરણના એવા પાંચ-પાંચ મતને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાનાં મા આશાપુરાના સમ ખાઉં છું, જય જય રાજપતાનાજય માતાજી.

રાજકોટમાં મા આશાપુરાના મંદિરે ૩૫૦ રેથી વઘક્ષત્રિય પરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન સમગ્ર રાજ્યના

ભાજપ પક્ષ માટે ખૂબ જ મોંઘ મોં સાબિત થયુંછે. પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હતી. ત્યારે ગત રાત્રેરાજકોટના આશાપરા मंहिर जाते मोटी संज्यामां क्षत्रिय સમાજના યવાનો અને વડીલો એકત્ર થયા હતા. જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવેતો આગામી લોકસભા ચંટણીમાં ભાજપ વિરૂદ્ધ ૧૦૦% મતદાન કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા હતા. રાજકોટના આશાપરા વધુ ક્ષત્રીય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા હતા અને

બેઠક પરના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની . માંગણી કરી હતી. આ સાથે જ

રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેવા શપથ ાણી કરી હતી. આ સાથે જ લેવામા આવ્યા હતા. પુરુપોત્તમ પુરૂપોત્તમ રૂપાલાની ટિકિટ રૂપાલાના નિવેદન અંગે ભાજપ

A ACE SOFTWARE EXPORTS LIMITED

બેઠક નિષ્ફળ ગઈ અને સર્વાન ુમતે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગે ચાલું રખાઈ છે. ત્યારે ભાજપ સામેનો ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહ્યો છે

સાથે ૨૬.७૮ લાખની છેતર

ઘરેણા બનાવવાનો ઓર્ડર આપી ૪૩૨ ગ્રામ સોનું પરત ન આપ્યાનો પુષ્કરધામના શખ્સ સામે નોંધાતો ગુનો

રાજકોટ,તા.૪ સોની વેપારીના ઘરેણા બનાવવા સોનું મેળવી બંગાળી કારીગર અવાર નવાર લાખોનું સોનુ લઈ કરાર થઇ જવાની ઘટના પ્રકાશમાં આવે છે. ત્યારે વાણીયાવાડીના કારીગરનું પુષ્કરઘામ સોસાયટીના વેપારી ૨૬.૭૮ લાખની કિંમતનું ૪૩૨ ગ્રામ ફાઇન સોનું ઓળવી ગયાની પોલીસમાં કરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વણીયાવાડી શેરી નંબર ૩માં રહેતા ચેતનભાઇ અરિવંદભાઇ ર્ઝીઝવાડીયાએ પષ્કરધામ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ રવજીભાઇ અકબરી સામે ૨૬.૭૮ લાખની કિંમતનું ૪૩૨ ગ્રામ સોનું ઓળવી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

સોની બજારમાં અલગ અલગ સોની વેપારીના સોનાના ઘરેણા બનાવી આપવાનું કામ કરતા ચેતનભાઇ ઝીં ઝુવાડીયાના પુત્ર ચિરાગના મિત્ર નિલેશભાઇ જોટાંગીયાએ પુષ્કરઘામ સોસાયટીમાં રહેતા અને સોની બજાર માંડવી ચોકમાં પદ્મવ પ્લાઝા ચેમ્બર્સમાં માનસી ગોલ્ડ નામની ઓફિસ ધરાવતા પ્રવિણભાઇ અકબરીનો પરિચય કરાવ્યો હતો. પ્રવિણભાઇ અકબરીએ સોનાના ઘરેણા બનાવવાનો ઓર્ડર આપ્યા બાદ તેના બદલામાં પોતે ફાઇન સોનું આપતા હોવાનું જણાવ્યું હતું. આથી ચેતનભાઇ ઝીંઝુવાડી અને પ્રવિણભાઇ અકબરીએ સોનાના ઘરેણા બનાવવાનો અવાર નવાર ઓર્ડર આપતા અને તેના બદલામાં ફાઇન સોનું આપી દેતા હતા.

પ્રવિણભાઇ અકબરીએ તા.૮ ફેબ્રુઆરીથી તા.૧૨ ફેબ્રુઆરી દરમિયાન સોનાના ઘરેણા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો તેના બદલામાં ૨૬.૭૮ લાખની કિંમતનંમ ૪૩૨ ગ્રામ ફાઇન સોનું લેવાનું થતું હતું તે સોનુ આપતા ન હોવાથી અવાર નવાર ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા પ્રવિણભાઇ ઝીંઝ્વાડીયાએ ખૂનની ઘમકી દીધાનું કરિયાદમાં જણાવ્યું છે. એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ.

બી.એચ.પરમાર સહિતના સ્ટાફે ચેતનભાઇ ઝીંઝુવાડીયાની ફરિયાદ પરથી પુષ્કરધામ સોસાયટીના પ્રવિણભાઇ અકબરી સામે ૨૬.૭૮ લાખની છેતરપિંડીનો ગુનો નોંઘી તપાસ

સમાજના યુવાનો અનેવડીલોએ શપથ લીધા છે. રાજકોટ લોકસભા મંદિર ખાતે આજે ૩૫૦ જે થી બેઠક પરના ભાજપના ઉમેદવાર

r. No.	Topic	y Amit Mansukhlal Mehta (" Acquirer ") together with Vaishali Amit Mehta (" PAC " Particular
1.	Date	April 04, 2024
2.	Name of the Target Company (TC)	Ace Software Exports Limited
3.	Details of the Offer pertaining to TC	The Open Offer is being made by the Acquirer and PAC to the Public Sharehol to acquire up to 16.02,590 Equity Shares representing the entire PI Shareholding constituting 25.04% of the Emerging Voting Capital of the TC Company at a price of 7.55 -pc etcuty Share, agreepating to a total consider of $₹.50.089.000$. payable in cash in accordance with Regulation 9(1)(a) of SEBI (ASAT) Regulations.
4.	Name(s) of the acquirer and PAC with the acquirer	Acquirer: Amit Mansukhlal Mehta PAC: Vaishali Amit Mehta
5.	Name of the Manager to the offer	Vivor Financial Services Private Limited Vivor Housen 1.1, Shash Colonn, Dop, Savidha Shopping Center, Paldi, Ahmedabad – 380007. Gijarrat, India. File No. 2: 917 9404 9242 Email Idi: Investors@wivo.net Contact Person: Shivam Patel Website: www.vivor.net SEBI Realistration No.: INMXXXXXIVOR122 Lithi: Idi:7106.11996PTC029182
6.	Members of the Committee of Independent Directors	Dharamshi Vadalia (Chairman) Vimal Kalaria (Member) Pratik Dadhania (Member)
7.	IDC Member's relationship with the TC	All IDC members are Non-Executive and Independent Directors of Target Company. Mr. Vimal Kalaria holds 1000 equity shares of the Company. None of the members of the IDC has any contracts or any relationship with Target Company.
8.	Trading in the Equity shares/ other securities of the TC by IDC Members	No member of the IDC has traded in any of the Equity Shares/ other securities of Target Company during the: 1. 12 (Twelve) months preceding the date of the PA. 2. Period from the date of the PA till the date of this recommendation.
9.	IDC Member's relationship with the acquirer	None of the members of IDC has any contract/ arrangement / relationship with Acquirer and / or with PAC.
10.	Trading in the Equity shares/ other securities of the acquirer by IDC Members	Not Applicable (As the Acquirer and PAC are individuals)
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of ₹ 35 per Equity Share is fair reasonable in terms of the SEBI (SAST) Regulations. However, the Public Shareholders of the Target Company should independiverulate the Open Offer and market performance of the Target Company's Et Shares and make their own informed decisions with respect to the Open Offer.
12.	Summary of reasons for the recommendation	The members of the IIIC have perused the following offer documents recommendation on the Gene Offer. 1. Public Announcement dated January 05, 2024 (*PA*) 2. Detailed Public Statement published on January 12, 2024 (*DB**). 3. Draft Letter of Offer dated January 19, 2024 (*DB**) 3. Draft Letter of Offer dated January 19, 2024 (*DB**) Based on the review of the offer documents, the members of the IDC is considered the following factors for medium fine recommendations: 1. The Acquirer intends to support the management of the Target Company in efforts bowards the sustained growth of the Target Company on only with the oddsing Promoties and the Target Company only with the oddsing Promoties and Formoties Group of the Target Compan accordance with FEBI (SAST) Regulations: 7. The Acquirer and PAC shall be Classified as the promoters of the Target Company accordance with FEBI (SAST) Regulations: 7. The Equity Stream or the Target Company are intrequently storaged on SSE in its of Regulations: 8. The Equity Stream or the Target Company are intrequently storaged on SSE in its of Regulations: 1. The Acquirer and the Target Company are intrequently storaged on SSE in its of Regulations: 1. The Acquirer and the Target Company are intrequently storaged on SSE in its of Regulations: 1. The Acquirer than accordance with STI and SQL of the SEBI SAST Regulations:
13.	Disclosure of the Voting Pattern	The recommendations were unanimously approved by the members of IDC.
14.	Details of Independent Advisors, if any.	None
15.	Any other matter(s) to be highlighted	None

ફવાડવા રોડ પર કારખાનામાંથી ૧ લાખનો પિત્તળનો ભંગાર ચોરાચે ઈમિટેશના દાગીના બનાવતી ફેકટરીની દીવાલમાં બાકોરૂં પાડી તસ્કરો ૮૫ કિલો પિત્તળ ઉઠાવી ગયા

રાજકોટ, તા.૪ કુવાડવા પંથકમાં તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ ગઈકાલે બેટી ખાતે કેબલની ચોરી થયા બાદ મેંગો માર્કેટ પાસે ઈમિટેશનના દાગીના પિત્તળની ભકીના કારખાનાની દીવાલમાં તસ્કરોએ બાકોરૂં પાડી રૂ. ૧ લાખની કિમતના ૮૫ કિલો પિત્તળની ચોરી

કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગની પોલીસમાંથી વેપાર ઘંઘો કરું છું.

પ્રાપ્ત વિગતો મુજબ,સામાંકાંઠે આડો પેડક રોડ ગુજરાત સોસાયતી મેઈન રોડ શ્યામ પાર્ક શેરી નં.-૦૧ પિતુ કુપા મકાનમાં રહેતા વિનોદભાઈ પરષોતમભાઈ લિંબાસીયા(પટેલ)(ઉ.વ.૫૮) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટ ખાતે અથ ર્વ એન્ટરપ્રાઈઝ નામની ઈમીટેશનની ભટ્ટી ચલાવી

જીયાણા ગામ ખાતે ખેતીના કામે ગયો હતો અને અમારૂ કારખાનુ મારો દિકરો ધર્મેશભાઈ સંભાળતા હતા અને અમારા કારખાનામાં ત્રણ કારીગરો કામ કરે છે. ગઈ તા.૩૧ના રોજ સવારના દસેક વાગ્યે મારા દિકરા ધર્મેશનો ફોન આવેલ અને મને વાત કરેલ કે આપડા કારખાનામાં સવારના આપડો

ગઈ તા.૩૦ના રોજ વાગ્યે કારખાને ગયેલ અને ડાયમાં દાગીના બનાવતા તાળુઓલી અંદર ગયેલ તો આપડા કારખાનાના દરવાજાની બાજુની દિવાલમાં બાકોરૂ પડેલ જોયેલ જેથી તેણે **મને** જાણ કરતા હું ત્યાં ગયો અને જોયુ તો ચોરી થઇ હોય તેમ જણાઈ છે તેમ મને વાત કરી હતી.

બાદમાં ત્યાર પછી હું અમારા કારખાને આવેલ અને જોયુ તો અમારા કારખાનામાં કારીગર અમિત સવારે આઠેક પિતળના દાગીના બનાવવાની

દાગીના આશરે ૮૫ કિલો કુલ રૂ. ૧,૦૨,૦૦૦ ના જોવામાં ના આવતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે. ડી.મારુ અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શસ્ત્ર કરી છે.

હોય અને તેમાં દાગીના પડેલ

હોય જે મેં ખાત્રી કરતા આ

जाहीर नोटीस

या नोटीस द्वारे सर्व जनतेस कळविण्यात येते की, आमचे अशिलांनी, खालीव वर्णनाची जमीन मिळकत खरेदी करण्याचे ठरविले आहे,

मिळकतीचे वर्णन

- नसरापर, तालका... कर्जत, जिल्हा ... रायगड

जमिन मालकाचे नाव	स. नं.	हि.नं.	क्षेत्र हे.आर.चौ.मी.	आकार रुपये, पैसे
मिलिंद मनोहर सप्रे	67	3	0.87.40	7.59

सदरहू जिमिनीवर कोणाही व्यक्तिमें, बैकिमें, वित्तीय संस्थेये कसल्याही प्रकारये करार-मदार, हक्क-हितसंबंध किंवा तांचे अक्षतामी-मुक्तायो किंवा तांचे वाली-वारस इत्यादी कोणावेंहें हक्क, दान, महाण, ब्रवीस, मोटी इत्यादी अकारेंद्र हक्क हितसंबंध असल्यास तांनी खाली मानूट केलेल्या पत्मावर १५ दिवसांचे आत वोध्य ता कार्यश्रीश कार्योच्यों प्रमुख्यास हम्में अस्पाता रही. भीराने आपन्या सरकारी नोदवाव्यात विहित मुद्रतीमध्ये हरकती न आल्यास आमचे अशील सदर निककती बाबतचा खरेदीखत/ करारनामा/ साठेखत/ कुलमुखत्यारपत्राचा पुढील व्यवहार पूर्ण करतील व त्यानंतर आलेल्या हरकती विचारात घेतल्या जाणार नाहीत व सदर जमीन करतील व त्यानतर आलेल्या हरकता ावचारात घतल्या आणार नाहात व शदर जमान मिळकती मध्ये कोणाचेही कोणत्याही प्रकारचे हक्क हितसंबंध असल्यास त्यांनी ते हितसंबंध जाणीव पूर्वक सोडून दिले आहेत, असे गृहीत धरले जाईल याची नोंद घ्यावी. कार्यालयीन पत्ता:- २८/बी विजय अपार्टमेंट १.

विजय नगरी, घोडबंदर रोड, ठाणे,

सही/-वकील विजयालक्ष्मी रुईकर पिन कोड- ४००६०७ मोबाईल - ९७०२१३५४३२

कब्जा सूचना

अ. इत.	कर्जक्र.	कर्जदार/ सह-कर्जदार/ हमीदार/गहाणदार	रोजी प्रमाणे १३(२) सूचना दिनांक/ धकीत देव (ह.)	दिनांक/चेळ आणि कण्जा प्रकार
2	४५६७९४२००००२०८ ख ४७६१९४३००००६९२	१) गजानन मुंदे, (कर्जदार), २) २) गोदावरी गजानन मुंदे (सह-कर्जदार)	२५/०१/२०२४ इ. ९,३९,८७३,२६ (३२४ नक लाख एकोणपाळीस हजार आस्त्रो स्थाप सब्बीस ऐसे मात्र) २३/०१/२०२४ रोजीस आणि त्याबरील ब्याज.	दिनांक : ०४-०४-२०२४ सेळ : डु. ०३.३० सांकेतिक कन्ना

ार्थ्य (प्रयोग पर तमा १०००तात १ वर्ष पण आगा १४००).

वार्थ्याओं किन सुन कहा, सुन कर्मा हा (इस्ति), पण्याचानी किता सक्तेची चारणेड करणास क्यू केती आस्ताचे वरिन सुन कर्मताचा आगि जानेना चुट्टो पूचना हैयान हैते कि, जमा सर्वेष्ठ प्रयासन क्षेत्र किताई प्रशासन क्षेत्र किता करणा करणा १३ (५) अस्त्र वर्षाची व्यवस्थान महत्त्र का स्थासन क्षेत्र किताई प्रशासन क्षेत्र केती, अपलेश क्षेत्र क्षेत्र क्षेत्र क्ष्मा क्षेत्र क्ष्मा क्षेत्र क्ष्मा क्षेत्र क्ष्मा क्ष्मा क्षित्र क्ष्मा क्ष्मा प्रशासन क्षेत्र केती, अपलेश क्ष्मा क सही/- प्राधिकृत अधिकारी जना स्मॉल फायनान्स वैक लिमिटेड करिता

जना स्मॉल फायनान्स बँक

जानां स्मारण प्राचनान्त्य वक्ष गोताणीका कार्याच्यः वि केश्वरंत , तक आणि प्रोचना करता, सर्वे कः, १०/१, ११/२ आणि १२/२वो, जोतान्त्व तत्तात्र, कार्यामणा इत्या पि रहेत, इंत्रीवल विद्यास पर्याच्या पुर, पल्लापहा, व्याच्यास – ६६००११, <u>त्राच्या कार्याच्याः</u> इकात्र कः, ४ आणि ५, तक प्रतस्ता, इंडियायुक्त विट, लविद्या अप्योद्या स्त्रीहरू (हिस्तरामी प्रियंतः) स्थावका शेट, कणे पर्याच्या-१००६१०

(2)

RALLIS INDIA LIMITED

कॉर्पोरंट आयहेन्टिटी नं. एवज ६९ १२०५ स्पाप्य १९४८ पीएलसी ०१४०८ ३ नॉवर्णाकृत कार्यालय : २३वा मजला, गीओस टॉबर, न्युक्त परह, ऑफ इस्टर्ग श्रीले, न्युक्त, गुंबई-४०००३७, इस्ट्रास्टर, १९४२ १४४० थ० येयसाईट:<u>www.rallis.com</u> ई-मेल:<u>investor relations@rallis.com</u>

सूचना

(कंपनीच्या समामाध्यस्त्राच्या माहितीसादी) कंपनीचे समामाधि इन्हेट्टर एनुकोगन और प्रोटेशान फंड (आवर्डगीएफ) आर्थारीटीम्बड हस्तांस्य वेळोबेळी मुधारीत इन्होस्टर एनुकेशन अंड डोटेशान फंड आंधारिटी (अकाउंटीग, ऑडिट, ट्रास्प्य अंड रिकंड) हस्स, २०१६ ("कस्त्र") महावाचन कस्त्री अधितेया, २०१३ (अधिरिया) आर्था करता १२४ (इ) ग्या लतुर्देश्वसर कर्माच्या भागधास्त्रांत याद्वार सूच्या देखात तेवे.

(अधानस्य) च्या कराम १.१९ (६) च्या लद्धदुस्सा कंपनाच्या भागपाधकाना चाहर प्रस्ता देणाव तेत्र । आधियाय आणि रात्य पार्थ अन्य गोशिसंतर प्रदत्त व केलेले /हारा व करता पहुं असलेले तरामां आवशियों एक कहें हरतातित करणाव्याच्या आणि सत्या सात किंवा जाता वर्षे च्यांच्या संध्यातीत लाभाग प्रदत्ता केला नाही/त्याचर हाता केला नाही ते होआ आवशियों अधादित्यां व्याद्धित्य अपना कराता काही/त्याचर हाता केला नाही ते होआ आवशियों हरतातरण व लाभावायं प्रदत्ता करणाया मार्या करणाया व्यावायतं किंवा नावाधिकरण किंवा वेधानिक प्रारंत्याच्या विनिद्धि अरात्र आवश्यास किंवा असे कोल हिंदिकार्थ कर्मने १९६६ च्या मार्युटीनिका विनिद्धि अरात्र आवश्यास्य किंवा असे कोल हिंदिकार्थ कर्मने असे कोलं अधादिकार्य करणाया कर्मने करणाया मार्या करणाया व्याद्धित्य वाहरी करणाया करणी असे कोलं अधादिकार करणाया करणाय

हत्तारात हरणाय पात्र उट्टान आहत जाता स्वापाय माध्याध्यक्ता त्याच्या ताराव्यक्त प्रथास देवीत्राक त्या पात्रदात आहें द्वाचा न करता पहुत आहें आणि प्रविचेत्र आहें कर प्रविचेत्र करता है। अपने क्षाचेत्र ताराव्यक्त कर प्रविचेत्र अवदेश अपने हत्त्वतीरत होगार आहेंक अणा संवर्षीय माध्याध्यक्षीय संपूर्ण त्याचित्र कंपनीन वित्ती वेत्रसार्थ <u>टिप्टान अपने क्षाचित्र कंपनीन वित्ती वेत्रसार्थ टिप्टान कंपनीन कं</u>

प्राथमध्ये स्वाचित्रं वाच्या न करूच्या लाभागालय कारान्। क्यान्याय वान्त्रहुत नक्ष्र ट्रान्स्कर एवंद एक्यूमें किंद्र प्राथमंत्र विद्या प्रायक्ष्टि स्वित्रं प्राथमंत्र विद्या प्रायक्ष्टि स्वित्रं वाच्या विद्या स्वाचित्रं वाच्या क्ष्या स्वाचित्रं वाच्या क्ष्या क

- नोंदवलेली होती ती मुळ शेअर प्रमाणपत्रे रह झाल्याचे आणि अपराक्राम्य असल्याचे गृहीर
- परल जाइल.
 इलेक्ट्रॉनिक स्वरूपांत धारण केलेल्या शेअर्ससाठी आवर्डपीएफ ऑथॉरिटीच्य

काणताहा दावा करता यणार नाहा. भागधारकांनी कृपवा ध्यानांत टेवावे की, आवर्डपीएफ डिमॅट अकांऊटमध्ये त्यांचे शेअसं

प्रणाणकारी वृश्या ज्यांने क्यांने की, आप्तर्गिणक हिंदि आनंक्राज्याने वाले ग्रेस्स स्वातिन व्राव्यान्त्रित, संस्थाटि आप्रताहित्याक्रिका प्रणाणकार विद्या ने स्थातिन व्राव्यान्त्रित में नामी अप्ति क्यांने क

ठिकाण : मुंबई दिनांक : एप्रिल ३, २०२४ (नोडल ऑफिसर)

G. M. BREWERIES LIMITED

M. CIN L15500MH1981PLC025809
CIN L15500MH1981PLC025809
sesh Niwas, S. Veer Savardar Marg, Prabhadevi, Mumbai 400 025.
4433 1150 1243 1151 1243 1139 278 59 19-22-2422 0722
Add Charlet / Vear ended March 31, 2024 (Rs. Lacs)

	Audited	Unaudited	Audited	Audited	Audited
Particulars		Quarter Ended			Year Ende
	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.202
Total income from operations (NET)	15,985	15,695	15,597	61,523	59,351
Profit/ (Loss) for the period					
(before tax, exceptional and extraordinary items)	9,451	3,062	4,507	18,121	13,162
Profit/ (Loss) for the period before tax					
	9,451	3,062	4,507	18,121	13,162
(after exceptional and extraordinary items)	8,664	2,260	3,510	15,152	9,987
Total Comprehensive income for the period					
(Comprising Profit /(Loss) for the period (after tax)					
and other comprehensive Income (After Tax)	8,664	2,260	3,510	15,152	9,987
Equity Share Capital (Face value of Rs,10/-per share)	1,828	1,828	1,828	1,828	1,828
Reserves excluding Revaluation Reserves as per					
		-	-	80,403	66,348
Basic & Diluted	47.40	12,37	19.19	82,90	54.6
	Total income from operations (NET) Profirst (Loss) for the period (before tax, exception) and extraordinary items) Profirst (Loss) for the period (before tax) Profirst (Loss) for the period before tax (differ exceptional and extraordinary items) Profirst (Loss) for the period affer tax (differ exceptional and extraordinary items) Iroal Comprehensive income for the period (comprising Profit (Loss) for the period (effer tax) Comprising Profit (Loss) for the period (effer tax) Equity Share Capital (Face value of Rs. 10)-per share) Equity Share Capital (Face value of Rs. 10)-per share) belance the eff or provious accounting year Estamps parts and (fac. 10-ac.)	Particulars	Particulars Quarter End	Particulars Quarter Ended 31,01,2023	Particulars Quarter Ended Vest Field

The a diversaid results have been reviewed by the audit committee and taken on record by the Board of Directors at its meeting held on Agril 04, 2024.

Provision for taxation includes provision for current tax and deferred tax (Current Tax (Rs.30.30 Crores) & Deferred Tax (Rs.45 Crores).

(red. U.o.) Corres).
The company soperation at present is confined to only one segment namely country liquor.
The board Offrectors of company has proposed for approval of taken bolders of which of dRAT per equity share of Ra, 10 each
The board of directors of the company has proposed to issue brunus shares in the ration of 1.4 i, e one bornus equity share
of Rs, 10 each for every four equity shares of Rs, 10 held, subject to necessary approvals.

of Rs. 10 each for every four equily shares of Rs. 10 heat, subject to necessary approvals.

If the four this control is not the state of the state For G M Breweries Limite

Chairman & Managing Director DIN 00111905 Place : Mumbai Date : April 4, 2024

सांकेतिक कब्जा सूचना

शास्त्रा कायानिय : आयशाआपतालाच भवा तरा, चानाराज हाराहा - ४००६० प्रतिद्वार हाराहा - ४००६० प्रतिद्वार हाराहा - ४००६०

ज्याजारी.

नियमसाक्ष्मीका है आपसीआवसीआय बैक तिसिटेड्डे प्रसिकृत अधिकारी या गायाने सिक्तुरियाडोजन अन्त तिकन्द्रकान और कावानियालन
अंदिय और प्रकोशिय औक सिक्तुरीतों होटेस्ट अंदर, २००३, कावम ११(१३) आणि सित्तुरियों होटेस्ट (एमोसीटे) रूप्त्य, २००५ सहायका
तियम ३ अन्यों आत्र क्रिमेस्टानों वास परक माणी सूचना जारी कर वासतिन सुन कर्त्याच्या सूचनीता ने युर कर्द्याचेन स्थान स्थानीत स्थान कर्त्याच्या स्थानीत स्थान हर क्ष्मित क्ष्मित स्थान स्थानीत स्थान

अ. क्र.		मिळकतीचे वर्णन / सांकेतिक कब्जाची तारीख	मागणी सूचनेची तारीख/ मागणी सूचनेतील रक्कम (रू.)	शाखेचे नाव
₹.	सुमन भगवान भालेकर आणि भगवान महादु भालेकर - एलबीएमयुएम००००४९८५११४	फ्टॉट क्र. ७०३, ७वा मबला, ए बिंग, शस्यु रेसिडेन्सी, अबव नगर रोड, कोम्पाड पाडा, आर्ट्स पार्कनवळ, सब्दे क्र. ३१/२/२ आणि ३१/२/३, शहर सब्दे क्र. ३५२८, ३५२८/ए, ३५२८/बी, ३५२८/सी, ३५२८/डी, ३५२८/ई, आणि ३५८८/एफ, कसार आळी, बॉगर्स पार्क रोड, मिवडी, टाणे ४११३०१/ एप्रिल ०१, २०१४.	₹.	मुंबई
₹.	आणि शितल एस. शिवलकर -	फ्लॅट क्र. २३५, १३वा मजला, अग.सी.सी. इमारत क्र. – बीर, अस्मिता ज्योती को-ऑपरिटल हार्कासण नोसायटी तिरा, सम्बान भूमीच्या समीर, मार्चे रोड, चारकोप जेलवन, सन्हें क्र. २६३, (मान आणि सी.टी.एस. क्र. ६५६ (भाग), मालाड परिचम, मालवणी, बोरीवली, मुंबई ४०००९५/ एप्रिल ०१, २०२४.	₹.	मुंबई
Þ.	स्वागत शिवलकर आगि प्रशांत शांताराम मिस्री -	फ्लंट क्र. १३५, १३वा मजला, अग.सी.सी. इमारत क्र. – बीर, अस्मिता ज्योती को-ऑग्सेटिक हार्जिम सोसावटी तिर, सम्मान भूमीच्या समीद, मार्चे रोड, बाग्लभेच जंबरान, सल्हें क्र. १३६, धामा आणि सी.टी.एस. क्र. ६ए (भाग), मालाइ पश्चिम, मालवणी, बोरीवली, मुंबई ४०००९५/ एप्रिल ०६, २०२४.	डिसेंबर १८, २०२३ ह. ९,०६,८३५/-	मुंबई
γ.	विलास शेटे आणि विलास बन्सी शेटे -	प्लॉट क्र. १३०४, १३वा मजला, इमारत क्र. बी, अग्रिशंत सिटी फेज २, व्हॅकॉलिंग, साई बाबा मंदिरजळळ, सर्जें क्र. ४५/१, ४५/२गी, ४९/३गी, ५०/१मी, ५२/१मी, ६४/२गी, ५३/३, ५५/भी, ५६/मी, ५७/३, ५७/४, ५७/४मी, ८५/१मी, ६६/२गी, मारलड, मीजे आणि तलाठी सजा टेमघर, ता – मिबंडी, ठाणे – ४२१३०२/ एप्रिल ६९, २०२४.	₹.	ठाणे
4.	कमलेश जैन -	फ्लंट क्र. ३१०३, ३१वा मजला, किंगस्टोन टॉका, परेल टॅंक रोड, जी. डी. आंबेडकर मार्ग, काळा चौकी, सीटीएस क्र. १८५ भाग, सब्वें क्र. १८५, १८६, १५९, १८३ भाग, १८४, नतीन सब्वें क्र. १/२४१३ भाग, २/१८३, मुंबई – ४०००३३/ एप्रिल ०१, २०२४.		मुंबई

राल नमुद्द कजदार/हमादारास याद्वार ३० ादवसात रकमचा भरणा करण्यास सूचना दण्यात यत आहे, अन्यया ग्रहाण ामळकता ाखब्युरता : एन्फोर्समेंट) कल्स, २००२ च्या निवम ८ आणि ९ च्या तरतुर्दी अंतर्गत सदर सूचना प्रकाशनाच्या ३० दिवसांच्या समाप्तीनंतर विकण्यात येतील

दिनांक : एप्रिल ०५, २०२४ ठिकाण: ठाणे, मुंबई

दिनांक : ५ एप्रिल, २०२४ ठिकाण : डोंबिवली, ठाणे

इंडो अमाईन्स लिमिटेड

सीआवादः एवर१९११एमएव१९१२पीएवसी०७००२२ सीवपः डक्प्यू - ४६ केजा, एम. आप. डी. सी. सीवियकी (पूर्व), किल्हा जाने - ४२१२०३, यु. क्र. ७०५५५२४०७/७०४५५२४००५/७४८८४५४८८/८२१०४८८२७ प्राप्त अवस्थातात्रकातात्रकातं (com. सीव्यक्षितात्रकात्रकात्रकातात्रकातात्रकातात्रका

सूचना

बाद्वारे इंडो अमाईन्स लिमिटेडच्या (''कंपनी'') सभासदांना केवळ रिमोट ई- मतदानाद्वारे पोस्टल बॅलेटद्वारे कंपनीच्य सभासदांद्वारे खालील विशेष व्यवसायाच्या व्यवहारासाठी कंपनी/प्रबंधक आणि शेअर हस्तांतरण एजंट (''आरटीए' લમાલદાવુદ લાભાભા લગાગ વ્યવસાવાચ્યા વ્યવસાયાના ભાગના) પ્રથમએ આગળ રાગ્ય હ્વાનાળા પુંત્ર (આંદાણ અથવા ક્રિતાક્ષિટ)(દ્વાસિટ્સ યોચ્યામક્કે સ્થાવે મોંદળોકૃત કૈમેલ મને ઓફ્રેત આળિ કર-આપિ તારીકા અર્થાત શુક્રવાર, ૧૧ માર્વ, ૨૦૧૪ રોક્ષી ત્યાંચ્યા સર્વ ધારળ કેહોલ્યા રોઅધાયાઓના ૪૫ પ્રપ્રિસ, ૨૦૧૪ રોક્ષી પોસ્ટલ લેંગ્લેટ સુધના કોપમીન પાડવલી આફે, અન્ના વર્શન સર પ્યસીપ મર્મ્યુલર્મનુસાર આળિ સર્વસાયાળ સમ્યુલ્ત રૂ. ટ્વિનાંક પપ્રિસ ૮, ૨૦૨૦ રોક્ષીચે पाठवला आहं, अवा। बरात स्वर एससाए संबद्धान्त्रीस आणा स्वत्यासाण संबद्धात्वर क्र. हिताक प्राप्तत ८, २००० राजांच १ १४/२००, दिताक प्रिप्त १३, २००० रोजीच १७/२०२०, दितांक १५ व्हार २००० रोजीच १०/२०२०, दितांक उद्दा २३, २०२१ रोजीच १०/२०११, दितांक ८ हिसंबर, २०११ रोजीचे १०/२०११, दितांक ०५ में, २०२२ रोजीचे १/२०२२, वितांक २८ हिसंबर, २०२२ रोजीचे १०/२०२२ आणि दितांक २५ सर्देय, २०२२ रोजीचे ०/२०२६ (फ्लॉक्टो प्रसार्टी एस्ट्रीएर्स) द्वारं ई – मतहानाद्वारे पोस्टल बॅलट् प्रक्रिया पेठन/भवंसाधारण सभा घोण्याकारिता निगम व्यवहार मंत्रात्व ('एससीए ') द्वारं हुए हैं निविद्या के त्यार के अध्या करें। के क्षा करें। के स्वात के स्वत के स्वात के स्वत के स्वात के स्वत के स्वात के स . अधिनियम २०१३ (''अधिनियम'') च्या कलम १०८ आणि कलम ११० च्या तरतदींनसार सचना देण्यात येत आहे.

ſ	अ.क्र.	ठरावाचे वर्णन
lÌ	१	''प्रवर्तक आणि प्रवर्तक गट श्रेणी'' पासून ''सार्वजनिक श्रेणी'' मध्ये भागधारण च्या पुनर्वर्गीकरणच्या मंजुरी

-- स्थानिक तारीख अर्थात शुक्रवार, २९ मार्च, २०२४ रोजी डिपाझिटरीद्वारे रेखभाल करण्यात आलेल्या लाभप्रद मालकांच्या नेंदणीत नोंदणीकृत असणाऱ्या नावांचे सभासद रिमोट ई-मतदानाद्वारे त्यांचे मत रेण्यासाठी हक्षदार असतील. कट – ऑफ तारखेरोजी ज्या व्यक्ती सभासद नाहीत त्यांना केवळ माहिती हेतूकरिता पोस्टल बॅलेट सूचना दिल्यासुसार वागणक देण्यात येईल.

नापुरुष-प्रचार प्रदान सर्वहुंतरमुसार, यूचनेच्या प्रत्यक्ष प्रती, पोस्टल बॅलेट अर्ज आणि प्रि – पेड बिड्नेस रिप्लाव पाकिटे सदर पोस्टल बॅलेटकरिता समासदांना पाठीक्यात वेणार नाहीत आणि केवळ रिमोट ई-मतदान पद्धतीद्वारे समासदांना त्यांची संस्ता/अस्मीत वेहिता वेहित सदर संदर्भात, ई-मतदान प्रक्रिवेचे स्वरूप आणि सूचना, विश्लेषणात्मक विवरणपत्रासह पोस्टल बॅलेट सूचना कंपनीचे

सदर संदर्भात, ई-मतदान प्रक्रियेचे स्वरूप आणि सूचना, विश्तेषणात्मक विवरणणदासह पोस्टल बेंतेट सूचना कंपनीचे संकेतस्वळ www.indoamineslictoom आणि वांध्यक्त निर्मिटेड का प्रेसित विस्तिटेड का संकेतस्वळ www.bssindia.com आणि www.nssindia.com येथून डाउनलोड करता थेईल. सर्व त्यांच्या समासदाना ई-मतदान पुरविच्याच्या हित्तकीला एतप्रस्तिप्तसह कंपनी सच्या गुतलेली आहे. ई-मतदान कालावार्यी गुक्कतान, ०५ प्रीत्म, ००० प्रेसी की. १०० (भाग्रव) सुरू होईल आणि शानिवार, ०४ प्रेस, २००२ राजेच संध्यक्ताकाळी ५,०० वा. (भाग्रवे)) एतं संस्थाकाळी ५,०० वा. (भाग्रवे)) एतं संस्थान संस्थान संस्थान स्थान संस्थान स्थान संस्थान संस्यान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्यान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्यान संस्थान संस्यान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्यान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्यान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्थान संस्य

क्षत्रनाच अवश्यक आण हतनातण एत्.द वाज्यातह त्याचा झत्य पता चाराशृत करण्याचा ावनाता आह. यंचालक महळान श्रा. विजय यादा, श्रामार क. एफसीएस १९९०), में, एक्सिएस ऑच इस्तोमित श्रामार के मार्गारत, कंपनी सिवन बांची योग्य आणि गाएदमी स्वरूपात पोस्टल बंतेट प्रक्रिया एडताव्यर्णाकरिता एडताव्यर्णाकार म्हणून स्वितृत्ती करण्यात आली आहे. इत कोणतेही शंका असल्यास तुन्ही www.evoting.nsdl.com च्या डाऊनलोडो स्वरूपात योग प्रचार मार्गारत स्वरूपात कर्मा एक्स्प्यूच्या आणि गाम्यारक्तामाई 5 - नात्त्रन वाप्यस्त्रती पुस्तिकेच्या संस्था प्रचार किया वर्षा स्थार प्रचार किया वर्षा स्थार प्रचार किया वर्षा स्थार प्रचार क्षित्र ०२२ -४८८६ ७००० आणि ०२२-२४९९ ७००० वर संपर्क साधाया किया evoting@nsdl.co.in येथे (एनएसडीएल अधिकारीचे नाव) एक विनंती पाठवावा

आक्तारा पानी (१६ विचार १६८वाव)। पोस्टल बेलेट्डाई -मतदानाचां निकाल ई-मतदानाच्या निकालाच्या ४८ तासांच्या आत आणि त्यानंतर नाही अशा कालावशीत घोषित करण्यात वेईल. असा निकाल पडताळणीकाराच्या निकालासह कंपनीचे संकेतस्थळ www.indoaminestid.com येथे उपलब्ध करून देण्यात वेईल आणि चीएसई लिमिटेड (वीएसई) आणि एनएसई लिमिटेड (एनएसई) यांना पुढेषा पोर्चण्यात वेईल.

इंडो अमाईन्स लिमिटेड सही/-विजय पालक व्यवस्थापकीय संचालक आणि सीईओ

डीआयएन: ००१३६०२७

डोंबिवली नागरी सहकारी बँक लि. DNS BANK (मल्टी-स्टेट शेड्यूल्ड बँक) अर्थाला विश्वास मिळे अन् विश्वासाला अर्थ मिळे!

ासूली विभाग : दुसरा मजळम, ^{*}मधूर्कज", पी-५२, एमआवहीसी, फेज-२, सोनार पादा, कल्वाण सिळ रोह, झौतेवली (पूर्व), जिल्हा ठाणे-५२ १२८ बुरयनी क्र.०२५१-२८४५०००/२८४५१९६, ई-मेल - **recovery@dnsb.co.in**

जाहीर लिलाव <u>नोटीस</u>

३०-११, २०१६ रोजीस ह. ७, ३१, १०-११, २० (रुपये सात कोटी बाहता तथान पनव द्वान रकते तीम आणि जीस पैसे मात्र)
०१,११, २०११ पासून अधिक कार्याच्या समुत्ती पर्यश्चे सामार्थिक हारने पूरील कार्या आणि विशेषण्य प्रमुत्तीकारी कार्याद्र स्थानने में सामग्रील हिन्दी होत्र सामग्रील हार्याच्या सामग्रील हार्याच्याच सामग्रील हार्याच हार्याच सामग्रील हार्याच हार्याच सामग्रील हार्याच हार्याच हार्याच हार्याच हार्याच हार्याच हार्याच हार्य

ı	मिळकतीचे वर्णन	राखीव	इसारा अनामत	निरीक्षणाची	लिलावाची
ı		किंमत	रक्रम (इअर)	तारीख आणि वेळ	तारीख आणि वेळ
	गरीबाचावाडा, ऑक्सफर्ड स्कुलच्या समोर, शिवाजीनगर, डॉबिवली		2,04,000/-	30/08/2058	०८/०५/२०२४
	(पश्चिम), तालुका कल्याण, जिल्हा ठाणे येथे स्थित न्यू ओमकार को-			स. ११,०० वा.	स. ११.०० वा.
	ऑपरेटिव्ह हाऊसिंग सोसायटी लि अशा ज्ञात आता रिद्धी सिद्धी अशा			ते दु. ३.००	
ı	ज्ञात पूर्वी बिल्डिंग च्या बी विंग (सामान्य क्षेत्रांसह) ३रा मजला वर फ्लॅट				
ı	क्र.३०१, मोजमापित ५४० ची.फू. (बिल्ट-अप)				

लिलावाचे ठिकाण : मधुकुंज, २रा मजला, पी-५२, फेज-२, एम.आव.डी.सी., कल्याण शिल रोड, सोनारपाडा, डॉबियली (पूर्व), ठाणे-४२१२०४.

- अर्थण मती.—

 किवीच्या अर्थी आणि मतीं असलेली बोली प्राप्त झेंबिबली मत्तरी सहकारी बँक लि., कोणत्याही काणच्या दिवारी स. १०.०० व सं.
 १.०० राया उपलब्ध असून प्रतंक बोलीमाती है. १८००) (विना-परावाण) पुरूष्ण प्रहान केल्याव मित्र करती के लि. हो कुल करील होनियाली है. १८००) (विना-परावाण) पुरूष्ण प्रहान केल्याव मित्र करती केल्या है मित्र करती केल्या केल्या है मित्र करती केल्या केल्या है मित्र करती केल्या क

- मारीकेत. अंबोतावार्ग सहनावांत सहभागी होणे आवक्क आहे. कथारि, बोत्तीदार्गनी त्याच्या/त्रिच्या/व्यांच्या व्वतीने सहभागी होत्याकरीता कोणत्याही व्यक्तीता प्राधिकृत केले असन्याय असा प्राधिकृत व्यक्तीने त्याच्या/तिच्या नावांत बोलीदार्गनी जारी केलेले प्राधिकृत या श्रेत्वारत्य संद्रवासा राज्या अनुत करते जाया व्यवस्थक आहे. मिक्टकत्रीती विक्री हैं 'अहारे वेशे आहे अत्री केशे अत्रो क्यो त्रात तत्यावा" 'काटकोराणो आहे. इच्छुक बोलीदार हे कोणताही दावा, प्रापा, यह, त्याद्वी, ध्वति आणि, क्षिका मिळकतीविवद्ध ज्यार्थित कोणतीही दश दायित्य काटी आस्त्यास, यार्थाव्यात त्यांची स्वतन्त्यी प्रोचकी करू कत्वता स्वद दायित्ये व्यवस्थी बोलीदार्गमा सहन करावे लागगार आहे. मिळकतीव कोणतेही विद्यमान ज्यार्थित द्यांचित असल्यास व्यक्तिता स्वोधतेही विद्यमान ज्यार्थित द्यांचित असल्यास विकेशना प्राहित सार्था
- लिलाव प्रक्रियेत प्रत्येक बोलीदाराला रु. २०,०००/ (रुपये वीस हजार मात्र) च्या किमान रकमेने बोली वादविण्याची परवानगी देण्या
- यसस्वी बोलीदारांना त्यांची बोली स्वीकारत्यावर म्हणजेच त्याच दिवशी किंवा पुढील कामकाजाच्या दिवशी साथं. ५.०० च्या आर्थ बोली रकमेच्या २५% देव (इअर घरुन) त्वरित भरावी लागणार आहे आणि उर्वरित रक्कम लिलावाच्या तारखेपासून १५ दिवसांत भराव
- लागत: वर बसित खंड (८) मधील नमुद्र बोली रकमेंचे २५% अदान करण्यास यशत्वी बोलीदार कसूरवार उत्त्यास, इसार सक्रम का केली जाईल आणि विकी ही रखालत केल्याचे मुहीत परले जाईल. तकेच वर विकी निष्यतीच्या तारखेगासून १५ दिवसात संपूर्ण रक्कम चुकर्त करण्यास मोलीदार कसूराय उत्तरास बोली कर्मच्या २५% खस्त्र केल का स्केल.
- वर्षात्व वंदार-विकास विकास कार्या क्षेत्र कर किया है। उसके विकास कार्याता, बैंक वसत्वी बोलीहारांच्या नावात विक्री विलेख वन्नेव वंदार अर्था वर्षा केल्या प्रमाण वंदार बोली हक्का करूवी प्राप्त झाल्याता, बैंक वसत्वी बोलीहारांच्या नावा नोर्दाशकृतिक विकास व
- ११. निर्धारित मदतीत संपूर्ण बोली रक्कम प्राप्त झाल्यानंतरच मिळकतीचा कव्जा खरेदीदारांच्या सपर्द केला जाईल

११. निर्धालि मुतालि समुण बोली एकस्त्र प्राप्त झाल्यानरावर प्रिकालिक करूता खर्रदिरायण्या सुग्द रुक्ता वार्यह.
१. कोणती सामग्द राज कोणती हिता सार्यकार (केला स्वार्यकार किला सिताल पुर क्ला वार्यह.)
१. कोणती सामग्द राज कोणती हात्र किला खर्चित प्राप्त केला सामग्द केला कार्यकार के प्राप्त देवा आहे.
११. हण्डुक कोलीदार निम्मलावर्धिकारों मोगांदित के. ७९७०९/८०६९/१/८००९९१-१८-१ वर पेथे संग्रें सामृ शकतात.
प्रत्यिती असिरियम, २००२ तृमार २० दिखारी विधालिक किंकी मुक्ता
कर्नदा/हमांद्र यांना यहाँ असिप्तिल करणाल केले की, परिची औरच्या करमा १२ च्या पोट करमा ८ का तारुदिसार किंकी आगों।
कर्नदा/हमांद्र यांना यहाँ असिप्तिल करणाल केले की, परिची औरच्या करमा १२ च्या पोट करमा ८ का तारुदिसार किंकी आगों।
मिताल केली विक्री/तिलाल केल्या जातीत व थकवाणि रुक्त व्याव अभिण खर्चीमह त्यांच्याकडून समूत केली वार्यंत.

दिनांक : ०५/०४/२०२४

प्राधिकृत अधिकार डॉबिवली नागरी सहकारी बँक लि.

*उपरोल्लेखित मराठी मजकुरामध्ये काही संदिश्यता असल्यास / आढळल्यास इंग्रजी मजकूर ग्राह्म मानावा

ACE SOFTWARE EXPORTS LIMITED 11 Everest (CIN: L72

ecommendations of the Committee of Independent Directors ("IDC") of Ace Software Exports Limited ("Targe "T"C") under Rejudition 26(") of Societies and Exclusion 50(") of Ace Software Exports Limited ("Targe ("Description of Committee of C

Sr. No.	Topic	Particular			
1.	Date	April 04, 2024			
2.	Name of the Target Company (TC)	Ace Software Exports Limited			
3.	Details of the Offer pertaining to TC	Company at a price of ₹ 35/- per Equity Share, aggregating to a total consist of ₹ 5,60,89,600/- payable in cash in accordance with Regulation 9(1)(a SEBI (SAST) Regulations.			
4.	Name(s) of the acquirer and	Acquirer: Amit Mansukhlal Mehta			
	PAC with the acquirer	PAC: Valshall Amit Mehta Vivro Financial Services Private Limited			
5.	Name of the Manager to the offer	Vivor House, 11, Tabashi Colony, Opp. Suividha Shopping Center, Paldi, Ahmedabad – 380007, Tabashi Colony, Opp. Suividha Shopping Center, Paldi, Ahmedabad – 380007, Gajarat, India. Tell No. ± 91 79 4040 4242 [Email Id: Investors@vivor.net Contact Person: Shivarn Patel Website: www.vivor.net SEBI Registration No.: InNix00010122 Intib. Id57106,01969FTC029182			
6.	Members of the Committee of Independent Directors	Dharamshi Vadalia (Chairman) Virnal Kalaria (Member) Pralik Dadhania (Member)			
7.	IDC Member's relationship with the TC	S. Friativ doublears (members) A fill IDC members are Non-Executive and Independent Directors of Target Company. Mr. Vimal Kladraf holds 1000 equity shares of the Company. None of the members of the IDC has any contracts or any relationship with Target Company.			
8.	Trading in the Equity shares/ other securities of the TC by IDC Members	No member of the IDC has traded in any of the Equity Shares/ other securities of Target Company during the: 1. 12 (Twelve) months preceding the date of the PA. 2. Period from the date of the PA fill the date of this recommendation.			
9.	IDC Member's relationship with the acquirer	None of the members of IDC has any contract/ arrangement / relationship with Acquirer and / or with PAC.			
10.	Trading in the Equity shares/ other securities of the acquirer by IDC Members	Not Applicable (As the Acquirer and PAC are individuals)			
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of ₹ 35 per Equity Share is fair a reasonable in terms of the SEBI (SAST) Regulations. However, the Public Shareholders of the Target Company should independed evaluate the Open Offer and market performance of the Target Company's Eq. Shares and make their own informed decisions with respect to the Open Offer.			
12.	Summary of reasons for the recommendation	The members of the IDC have porused the following offer documents recommendation on the Open Offer. 1. Public Announcement dated January 65, 2024 ("PR") 2. Detailed Public Stement published on January 12, 2024 ("DR"), 3. Draft Letter of Offer dated January 59, 2024 ("DLE") 3. Draft Letter of Offer dated January 19, 2024 ("DLE") Based on the review of the offer documents, the members of the IDC is considered the following factors for making free recommendations: 1. The Acquirer intends to support the menagement of the Target Company in It efforts towards the sustained growth of the Target Company in It efforts towards the sustained growth of the Target Company in It efforts towards storp remoters and the Target Company on With the desting Periodors and Stell (JODR) Regulations. 7. The Acquirer and PAC shall be classified as the promoter Group of the Target Company accordance with SEBI (SAST) Regulations and SEBI (JODR) Regulations. 7. The Early Stress or the Target Company as introquently traded on BSE is the of Regulation 2(1)(i) of the SEBI SAST Regulation.			
13.	Disclosure of the Voting Pattern	The recommendations were unanimously approved by the members of IDC.			
14.	Details of Independent Advisors, if any.	None			
	Any other matter(s) to be highlighted	None			
To the	best of our knowledge and beli ement is, in all material respect,	ef, after making the proper enquiry, the information contained in or accompan true and correct and not miskading, whiten by the ornission of any information or required to be disclosed by the Target Company under the SEBI SAT Regulation For and on behalf of the Committee of Independent Director. Ace Software Exports Lim			

Place: Rajkot Date: April 04, 2024